



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૧/૦૭/૨૦૧૯ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૦૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૭ કેસ કરી, ૪૨ વ્યક્તિઓને ઝડપી, ૨૩૪ લીટર દેશી દારૂ, ૨૬ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૦૧ સ્કુટર કબજે કર્યું હતું. તેમજ જુગારધારા હેઠળ ૦૧ કેસ કરી, ૦૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૫,૨૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૦૩/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૩૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૬ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

લુંટ :-

સમાચાર યાદી નં.૧૧૦૪/૧૯

સોલા હાઇકોર્ટ : રજનીકાંતભાઈ રતનસિંહ ઠાકોર (ઉ.વ.૩૪)(રહે.ડીવાઇન રેસીડેન્સી, સત્યમ કોમ્પ્લેક્ષની સામે, સાયન્સ સીટી રોડ સોલા) એ તા.૩૦/૦૬/૨૦૧૯ બપોરના ૨/૩૦ વાગ્યાના સુમારે ભાડજ ગામની કેનાલ થી શીલજ સર્કલ બાજુ પોતાની એક્ટીવા ચલાવી પસાર થઇ રહ્યા હતા દરમ્યાન એક એક્ટીવા ઉપર આવેલ પુરૂષ તથા બે મોટર સાયકલ ઉપર આવેલ ચાર પુરૂષ મળી કુલ પાંચ અજાણ્યા ઇસમોએ ભેગામળી રજનીકાંતભાઈ ને પાછળ થી ચપ્પા જેવું અડાડી “ચુપ-ચાપ ઉભો રહે” “શુ છે તારી પાસે” તેમ કહી રજનીકાંતભાઈના પેન્ટના ખીસ્સામાંથી રોકડ રૂપિયા ૩૨,૦૦૦/- તથા અગત્યના દસ્તાવેજો મુકેલ પર્સ કાઢી લઇ લુંટ કરી નાસી ગયા છે. આ અંગે રજનીકાંતભાઈ ઠાકોરે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.એમ.પરમાર ચલાવે છે.

સોનાની ચેઇન ખેંચી તોડી લઇ ગયા :-

સમાચાર યાદી નં.૧૧૦૫/૧૯

નરોડા : અક્ષયકુમાર રામેશ્વરી પ્રસાદ (ઉ.વ.૫૮)(રહે.સન એકજઝોટીકા સોસાયટી ગેલેક્ષી-૮૮ સોસાયટીની બાજુમા હંસપુરા નરોડા) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩૦/૦૬/૨૦૧૯ સવારના ૯/૧૫ વાગ્યાના સુમારે નરોડા જી.ઇ.બી.પાસે, રાઘવ રેસીડેન્સી સામે આવેલ રોડ ઉપર થી પત્ની સાથે એક્ટીવા ચલાવી પસાર થઇ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાયકલ પર આવેલ બે પુરૂષ (૨૫ થી ૨૮ વર્ષના આશરાનાં) અક્ષયકુમારની પત્નીના ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેંચી તોડી લઇ નાસી ગયા છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી જયેંદ્રસિંહ રૂપસિંહ ચલાવે છે.

સાબરમતી : સંદિપભાઈ બૈજનાથસિંહ રાજપુત (ઉ.વ.૩૩)(રહે.શંકરનગર સોસાયટી રાધાસ્વામી રોડ રાણીપ) એ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૯/૦૬/૨૦૧૯ રાતના ૧૧/૩૦ થી તા.૩૦/૦૬/૨૦૧૯ સવારના ૮/૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન ન્યુ રાણીપ આશ્રય-૯ ની બાજુમા સાત્વ હોમ્સ બંગલોઝ નંબર-૧૧૦ ના પાર્કિંગમા પોતાની ફોરચ્યુનર ડીઝલ કાર નંબર જીજી.૦૧.આર.ઝેડ.૦૪૭૫ કિંમત રૂપીયા ૩૦,૦૦,૦૦૦/- પાર્ક કરી મુકી હતી. જેની કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.ટી.દેસાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.